



ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ - કેન્દ્રીય કપાસ સંશોધન કેન્દ્ર, નાગપુર

ICAR-Central Institute for Cotton Research, Nagpur

An ISO 9001:2015 Certified Organization



૧૦ થી ૧૬ ઓક્ટોબર ૨૦૨૭ દરમ્યાન કપાસની ખેતી પદ્ધતિ માટે ૨૧ મી અઠવાડિક સલાહ

ગુજરાત		છેલ્લા અઠવાડિયામાં પડેલ ખરેખર વરસાદ (મીભી)					આગામી અઠવાડિયા માટે સુચિત / પુર્વાનુમાન વરસાદ (મીભી)				
		ઓક્ટોબર					ઓક્ટોબર				
		૦૫	૦૭	૦૮	૦૯	૧૦	૧૨	૧૩	૧૪	૧૫	૧૬
	અમરેલી	૦	૦	૦	૦	૦	૦	૦	૦	૦	૦
	ભાવનગર	૦	૦	૦	૦	૦	૦	૦	૦	૦	૦
	જામનગર	૦	૦	૦	૦	૦	૦	૦	૦	૦	૦
	રાજકોટ	૦	૦	૦	૦	૦	૦	૦	૦	૦	૦
	જુનાગઢ	૦	૦	૦	૦	૦	૦	૦	૦	૦	૦
	સાબરકાંઠા						૦	૦	૦	૦	૦
	સુરેન્દ્રનગર	૦	૦	૦	૦	૦	૦	૦	૦	૦	૦
	અમદાવાદ	૦	૦	૦	૦	૦	૦	૦	૦	૦	૦
	વડોદરા	૦	૦	૦	૦	૦	૦	૦	૦	૦	૦
	પાટણ	૦	૦	૦	૦	૦	૦	૦	૦	૦	૦
	મહેસૂસાણા						૦	૦	૦	૦	૦
કુલ પડેલ વરસાદ અને પ્રમાણિત રંગ		૦.૧ થી ૨.૪ મીભી	૨.૫ થી ૧૫.૫ મીભી	૧૫.૬ થી ૬૪.૪ મીભી	૬૪.૫ થી ૧૧૫.૫ ૧૧૫.૫	૬૪.૫ થી ૧૧૫.૫ ૧૧૫.૫	૧૧૫ થી ૨૦૪.૪ મીભી				
પડેલ વરસાદનું વર્ગીકરણ		ખૂબ જ ઓછો વરસાદ	ઓછો વરસાદ	મધ્યમ વરસાદ	ભારે વરસાદ	ભારે વરસાદ	અતિ ભારે વરસાદ				

પાક પરિસ્થિતિ :

સુરત ખાતે વાવડી કરેલ પાક ૧૦૫ થી ૧૧૦ દિવસનો જીડવા ખીલવાની અવસ્થાએ છે. હાથથી નિંદામણ સફાઈનાં કાર્યો કરવામાં આવેલ છે. લીલાં તડતડીયાની વસ્તીએ આર્થિક ક્ષમ્ય માત્રા વટાવેલ છે. મોલોમણી અને ગુલાબી ઈયળની વસ્તી (કુલોમાં) ઓછાથી મધ્યમ પ્રમાણમાં નોંધાયેલ છે. ખેતરમાં મીલીબગની વસ્તી છૂટી-છવાયી જોવા મળેલ છે. ખૂણિયાં ટપકાનો રોગ મધ્યમ પ્રમાણમાં અને પાન લાલ થવાનો રોગ ઓછા પ્રમાણમાં નોંધાયેલ છે.

જુનાગઢ ખાતે વાવડી કરેલ પાક ૧૦૫ દિવસનો કુલ અને જીડવા ખીલવાની અવસ્થાએ છે. પિયત આપવાની અને દવા છાંટવાની કામગીરી થયેલ છે. કેટલાંક સ્થળોએ સફેદ માણી, લીલાં તડતડીયાનાં ઉપદ્રવ અને ટોબેકો સ્ટ્રોક વાયરસની શરૂઆત થયેલ છે. ફેરોમોન ટ્રેપમાં ગુલાબી ઈયળનાં કુંદા પકડવામાં આવેલ છે. કેટલાંક ખેતરોમાં કોરીનોસ્પોરા પાનનાં ટપકાનો રોગ અને ગ્રે મીલદયું જોવામાં આવેલ છે જ્યારે ઘણાં ખેતરોમાંએ સુકારો નોંધવામાં આવેલ છે.

સલાહ :

સુરત ખાતે ખેડૂતોને, ઉગેલ પાકમાં હલ્કી જમીનમાં ઝીકની ઉષાપને ઓછી કરવા યુરીયા @ ૨% અને ઝીક સલ્કેટ ૨૧% @ ૦.૫% પ્રમાણે અને મેનેશીયમની ઉષાપ ઓછી કરવા મેનેશીયમ સલ્કેટ @ ૧% પ્રમાણે છંટકાવ કરવાની સલાહ છે. બીટી કપાસમાં લાલ પાન થવાની સમસ્યાનાં નિયંત્રણ માટે સંપૂર્ણ ખેતરમાં કુલોનું બેસાણ વધુ હોય ત્યારે અને જીડવા વિકાસની અવસ્થાએ એમ બે વખત ૧૫ દિવસનાં આંતરે મેનેશીયમ સલ્કેટ @ ૧% + યુરીયા ૧% આપવું જીડવાનું બેસાણ સુધારવા અને કુલોનું ખરણ અટકાવવા પોટેશિયમ નાઈટ્રેટ(૧૩:૦:૪૫) @ ૨% એટલે કે ૨ કિલો પોટેશિયમ નાઈટ્રેટ ૧૦૦ લી. પાણીમાં ઓગાળીને છંટકાવ કરવો અથવા નેણેલીક એસેટીક એસીડ ૪.૫ એસએલ @ ૪.૦ મીલી પ્રતિ ૧૦ લી. પાણીમાં નાંખી છાંટવું. મીલીબગનાં છૂટાછવાયા યજમાન પાકો અથવા નિંદામણો અને અસરગ્રસ્ત છોડોને ઉખાડી તેનો નાશ કરવો. જો ચુસીયાં પ્રકારની જીવાતો તેની આર્થિક ક્ષમ્ય માત્રા વટાવે તો ફલોનીકામીડ ૫૦ ડિબલ્યુજી @ ૪ ગ્રામ અથવા ડાયનોટેફ્ક્યુરાન ૨૦ એસેજી @ ૩ ગ્રામ અથવા બુપ્રોફેની ૨૫ ઈસી @ ૨૦ મીલી / ૧૦ લી. પાણીમાં નાંખી છંટકાવ કરવો. ગુલાબી ઈયળની મોજણી માટે ફેરોમોન ટ્રેપ (૫ પ્રતિ હેક્ટર) લગાડવા. જ્યાં ગુલાબી ઈયળ તેની આર્થિક ક્ષમ્ય માત્રા વટાવે (૧૦% ફળાઉ ભાગોમાં નુકશાન) ત્યાં કલોરાપાયરીઝેસ ૨૦ ઈસી @ ૨૫ મીલી અથવા કલીનાલફેસ ૨૦ એન્ડેન્ડ @ ૨૦ મીલી અથવા પ્રોફેનોઝેસ ૫૦ ઈસી @ ૩૦ મીલી અથવા ઈનોક્ષાકાર્બ ૧૪.૫ એસસી @ ૧૦ મીલી/ ૧૦ લી. પાણીમાં નાંખી છંટકાવ કરવો. સુકારા અને મૂળનાં કોહવારા રોગનાં વ્યવસ્થાપન (દેશી કપાસ) માટે ઉપદ્રવિત છોડોની આજુબાજુ કાર્બન્ડેજીમ ૫૦% વે.પા. @ ૧.૨ ગ્રામ/ લી. અથવા ટ્રોયકોડમાં હરજીયમ અથવા ટ્રોયકોડમાં વિરીડી ૧૦ ગ્રામ/ લી. પાણીમાં આપવું અને દેશી કપાસમાં ફ્યુઝારીયમ ફુંગથી થતાં સુકારા રોગનાં નિયંત્રણ માટે સંક્રમીત છોડીયી ૧ મી.ની ત્રિજ્યામાં રહેલ તંદુરસ્ત છોડોનું પણ સદર માવજત આપવી. જીડવાનો સડો અને ખૂણિયાં ટપકાનો રોગ આવતો અટકાવવા માટે કોપર ઓક્સિક્લોરાઇડ ૫૦ ડિબલ્યુઝી/ ડિબલ્યુજી @ ૨૫-૩૦ ગ્રામ પ્રતિ ૧૦ લી. પ્રમાણે આપી વ્યવસ્થાપન કરવું. છોડમાં જોવા મળતા ફુંગથી થતાં ટપકાંઓ તથા મૂળનાં કોહવારા અને અન્ય બ્લાઈટ જેવાં રોગોનાં

વવસ્થાપન માટે કાર્બન્ડેજીમ ૧૨% + મેન્કોઝેબ ૫૩% ડબલ્યુપી @ ૩૦ ગ્રામ અથવા પ્રોપીકોનાજોલ ૨૫ ઈસી @ ૧૦ મીલી અથવા કાર્બન્ડેજીમ ૫૦ ડબલ્યુપી @ ૪ ગ્રામ અથવા ફલુક્ષાપાયરોક્ષાડ ૧૬૭ ગ્રામ/ લી. + પાયરાકલોસ્થોબીન ઉત્ત ગ્રામ/ લી. એસસી @ ૬ મીલી અથવા એઝોક્ષાસ્ટ્રોબીન ૧૮.૨% ડબલ્યુ/ ડબલ્યુ + ડાયફેનોકોનાજોલ ૧૧.૪% ડબલ્યુ/ ડબલ્યુ એસસી @ ૧૦ મીલી અથવા મેટીરામ ૫૫% + પાયરોકલોસ્ટ્રોબીન ૫% ડબલ્યુજી @ ૨૦ ગ્રામ ૧૦ લી. પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવાની સલાહ આપવમાં આવે છે.

જુનાગઢ ખાતે ખેડુતોને નાઈટ્રોજન ખાતરનો પૂર્તિ હપ્તો (૨૫ કિલો યુરીયા અને ૧૫ કિલો પોટાશ પ્રતિ એકર) અને પાણીમાં દ્રાવ્ય ખાતર ૧૩-૦-૪૫ (એન-પી-કે) @ ૧૦૦ ગ્રામ સાથે મલ્ટી માઈક્રો ન્યુટ્રિયન્ટ માઈક્રો મીન્ટ્રેડ-૪ ૧૫ ગ્રામ ૧૦ લી. પાણીમાં આખ્યાં બાદ હળવું પિયત આપવાની સલાહ છે. કપાસનો વધુ પડતો વાનસપતિક વૃદ્ધિ અટકાવવા માટે ૭૫ દિવસ બાદ તેની દુંખ તોડવી. જો લીલાં તડતરીયા તેની આર્થિક ક્ષમ્ય માત્રા કરતાં વધુ નોંધવામાં આવે તો ફલોનીકામીડ ૫૦ ડબલ્યુજી @ ૪ ગ્રામ અથવા ડાયનોટેક્યુરાન ૨૦ એસજી @ ૩ ગ્રામ પ્રતિ ૧૦ લી. પાણીમાં મિશ્ર કરી છાંટવું. સફેદ માખીની વસ્તીને નિયંત્રિત કરવા પાયરીપ્રોક્ષીફેન ૧૦ ઈસી @ ૨૦ ગ્રામ પ્રતિ ૧૦ લી. પાણીમાં અથવા ડાયનેનથ્યુરોન ૫૦ ડબલ્યુપી @ ૨૦૦ મીલી પ્રતિ એકર મુજબ છાંટવું. પાકમાં ગુલાબી ઈયળનાં ફુદાની મોજણી કરવા માટે એકર દિંક ૨ ફેરોમોન ટ્રેપ લગાડવા અને પાકમાં ફુદાની વસ્તીની નોંધણી કરવી. ખેતરમાંથી ગુલાબી ઈયળથી ઉપદ્રવિત કળી અને રોઝેટ કુલો (ઉપદ્રવિત કુલો) ભેગા કરી નાશ કરવો જેથી ગુલાબી ઈયળની વસ્તીનો ફેલાવો અટકે. જો ગુલાબી ઈયળનો ઉપદ્રવ તેની આર્થિક ક્ષમ્ય માત્રા વટાવે તો એમામેક્ટીન બેન્જોએટ પ એસજી @ ૫ ગ્રામ અથવા પ્રોફેનોફોસ ૫૦ ઈસી @ ૩૦ મીલી અથવા ઈન્ડોક્ષાકાર્બ ૧૪.૫ એસસી @ ૧૦ મીલી પ્રતિ ૧૦ લી અથવા લીબોડીનાં મીજનો અર્ક ૫% અથવા લીમડાનું તેલ @ ૫૦ મીલી પ્રતિ ૧૦ લી. પ્રમાણે પાણીમાં નાંખી છંટકાવ કરવો. ઉપલબ્ધી હોય તો ગુલાબી ઈયળનાં જૈવિક નિયંત્રણ માટે ઈડાના પરજીવી ટ્રાયકોગ્રામેટોઇડી બેકટરી ૧.૫ લાખ પ્રતિ હેક્ટાર છોડવા. શ્રીસ્નાનું નિયંત્રણ કરવું અને ટોબેકો સ્ટ્રીક વાયરસની ચકાસણી માટે કોંગ્રેસ ધાસ (પર્યાનીયમ) નિંદામણને કાબુમાં રાખવું. ફુગથી થતાં રોગો અને કોરીનોસ્પોરા પાનનાં ટપકાનાં રોગનાં નિયંત્રણ માટે ફલુક્ષાપાયરોક્ષાડ ૧૬૭ ગ્રામ/ લી. + પાયરાકલોસ્થોબીન ઉત્ત ગ્રામ/ લી. એસસી @ ૦.૬ મીલી/ લી. અથવા મેટીરામ ૫૫% + પાયરોકલોસ્ટ્રોબીન ૫% ડબલ્યુજી @ ૨ ગ્રામ/ લી. અથવા કાર્બન્ડેજીમ ૫૦ ડબલ્યુપી @ ૧.૨ ગ્રામ/ લી. પાણીમાં ભેગુ કરી છાંટવું. સુકારા અથવા મૂળનાં કોહવારા રોગનાં યોગ્ય નિયંત્રણ માટે ટ્રાયકોડર્માં હરજીયમ અથવા ટ્રાયકોડર્માં વિરીડી છાણિયું ખાતર અથવા સેન્દ્રીય ખાતરમાં ભેગવી જમીનમાં ૨.૫ કિલો/ હે. મુજબ આપવું અથવા કાર્બન્ડેજીમ ૫૦ વેપા. @ ૧.૨ ગ્રામ/ લી. પાણીમાં ભેગવી સંક્રમિત છોડોનાં મૂળ વિસ્તાર નજીક દરેકવું. ગે મીલદ્યુને નિયંત્રિત કરવા એઝોક્ષાસ્ટ્રોબીન ૧૮.૨% ડબલ્યુ/ ડબલ્યુ + ડાયફેનોકોનાજોલ ૧૧.૪% ડબલ્યુ/ડબલ્યુ એસસી @ ૧૦ મીલી અથવા કેસોક્ષીમ મીથાઈલ ૪૪.૩ એસસી @ ૧૦ મીલી અથવા કાર્બન્ડેજીમ ૧૨% + મેન્કોઝેબ ૫૩% ડબલ્યુપી @ ૩૦ ગ્રામ/ ૧૦ લી. પાણીમાં નાંખી છાંટવાની જલામણ છે. જો ખેતરમાં અચાનક સુકારો અથવા ધીમો સુકારોનાં લક્ષણો જોવ મળે તો કાર્બન્ડેજીમ ૫૦ ડબલ્યુપી @ ૧૨ ગ્રામ + યુરીયા ૧૫૦ ગ્રામ ૧૦ લી. પાણીમાં મિશ્ર કરી અસરગ્રસ્ત છોડોની ફેરેટ દરેકવું.

કપાસ ઉત્પાદનની તાંત્રિકતા આધારિત વિસ્તૃત માહિતી દા.ત. જમીનની પસંદગી, જાતો/ સંકરો, ખાતર આપવાની પદ્ધતિ, વાવણીની રીત, પિયત પદ્ધતિઓ, નિંદામણ, કિટકો અને રોગોનું વવસ્થાપન વિગેરેની માહિતી એન્ડ્રોઇડ આધારીત CICR Cotton App. કે જે ICAR-CICR, નાગપુર દ્વારા તૈયાર કરેલ છે. આ એપ ગુગલ પ્લે સ્ટોરમાંથી વિના મુલ્યે ડાઉનલોડ કરી શકાય છે. વધુમાં, પાક વૃદ્ધિ અવસ્થા અને હવામાન આધારિત અંકવાડિક સલાહ ICAR-CICR, નાગપુરની વેબસાઈટ ઉપર ગુજરાતી ભાષામાં ઉપલબ્ધ છે જેનો લાભ ખેડુતો લઈ શકે છે.